

## શેઠ ડી. એમ. પોલિટેકનિક ઇન હોર્ટીકલ્ચર, વડોદરા ખાતે “હોર્ટીકલ્ચર ડે”

### ની ઉજવણી કરવામાં આવી

શેઠ ડી. એમ. પોલિટેકનિક ઇન હોર્ટીકલ્ચર, વડોદરા ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત તારીખ ૦૮-૦૮-૨૦૨૨ ના રોજ પ્રથમ “હોર્ટીકલ્ચર ડે” ની ઉજવણી નું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ડો. જે. એમ. તુવાર, સંયુક્ત બાગાયત નિયામકશ્રી, ગુજરાત રાજ્ય, વડોદરા. મુખ્ય મહેમાન તરીકે ડો. એસ. જે. પટેલ, નિવૃત્ત આચાર્ય અને યુનિટ અધિકારીશ્રી, મોડેલ ફાર્મ, વડોદરા. અતિથિ વિશેષ તરીકે ડો. બી. એન. પટેલ, યુનિટ અધિકારીશ્રી, કઠોળ સંશોધન કેન્દ્ર, મોડેલ ફાર્મ, વડોદરા તથા કોલેજના આચાર્યશ્રી ડો. બી. એચ. પંચાલ હાજર રહેલ હતા. સૌપ્રથમ કોલેજના એકેડેમિક ઇન્ચાર્જશ્રી, ડો. વિ. કે. પટેલ દ્વારા મહેમાનોનું શાબ્દિક તથા ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ આવેલ મહેમાનોએ ટીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનું ઉદઘાટન કર્યું. ડો. બી. એચ. પંચાલ દ્વારા પ્રસંગિક ઉદબોધન કરવામાં આવ્યું જેમાં તેઓએ બાગાયત નું મહત્વ તેમજ ભારતના વિકાસમાં બાગાયતના ફાળા તથા ડો. એમ. એચ. મારીગોવડા ને ફાધર ઓફ હોર્ટીકલ્ચર ઇન ઈન્ડીયા અને ડો. કે. એલ. ચંદ્રને ફાધર ઓફ મોડર્ન હોર્ટીકલ્ચર ઇન ઈન્ડીયા તરીકે બિરદાવવામાં આવે છે તે અંગેની વિસ્તૃત જાણકારી આપી. મુખ્ય મહેમાન શ્રી ડો. એસ. જે. પટેલ દ્વારા આવા અનોખા કાર્યક્રમને બિરદાવવામાં આવ્યો અને આવા કાર્યક્રમ વારંવાર થતા રહે તે અંગે સૂચન કર્યું. કાર્યક્રમના અધ્યક્ષશ્રી ડો. જે. એમ. તુવાર દ્વારા વિદ્યાર્થીઓને બાગાયત ને લગતી રોજગારની તકો, બાગાયત ખાતું, ગુજરાત રાજ્ય દ્વારા ચાલતી વિવિધ સહાય લક્ષી યોજનાઓ તેમજ એક્સેલન્ટ સેન્ટર વિશે માહિતી આપવામાં આવી.

હોર્ટીકલ્ચર ડે નિમિત્તે કોલેજ દ્વારા બાગાયત ક્વિઝ કોમ્પિટિશન, વફૂત્વ સ્પર્ધા “વર્તમાન ભારતના વિકાસમાં બાગાયત નો ફાળો” અને પોસ્ટર પ્રેઝન્ટેશન “બાગાયત અને તંદુરસ્તી” તેમજ બાગાયતી પાકોમાં પ્રસર્જનની સ્પર્ધા જેવા વિવિધ પ્રકારના કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા. તદુપરાંત તમામ વિદ્યાર્થીઓને “ગ્રો યોર સેલ્ફ” થીમ બેઝ પર શાકભાજીના છોડ પોલીબેગમાં જતન કરવા માટે આપવામાં આવ્યા. સદર દિવસે આણંદ ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાયેલ હર ઘર તિરંગા કાર્યક્રમમાં ભાગ લેનાર અત્રેની કોલેજની વિદ્યાર્થીની પટેલ રિયા (પોસ્ટર પેન્ટીંગ) અને પરમાર શ્વેતાએ તથા (નિબંધ સ્પર્ધા)માં બીજા ક્રમાંકે આવેલ હોય તેમનું સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા બહુમાન કરવામાં આવ્યું. અંતમાં ડો. આઈ. એન. ભાભોર દ્વારા તમામ મહેમાનો તેમજ વિદ્યાર્થીઓનું આભાર માનીને કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો





